



## કુદરતી પ્રચાર કેન્દ્ર

ગોમટા, તા. ગોંડલ, જી. રાજકોટ - 360 320

ફોન : 02825-285401 / 2 ફોન નંબર : 70961 77767 / 72010 77767

વૈશ્વાનર : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org) ઈમેઇલ : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)



### ગર્ભસંસ્કાર

સોળ સંસ્કારનો પ્રથમ સંસ્કાર

**શુરવીર, કાંતિકારી, દ્વાયાળુ,  
દાનવીર, શાંત, સુશીલ**

**ઉત્તમ ગૃહણો ધરાવતું સ્વસ્થ બાળક  
મેળવવા નું માર્ગદર્શન**

ગર્ભસંસ્કાર એટલે શું ?

ગર્ભસંસ્કાર શા માટે જરૂરી છે ?

ગર્ભ ધારણા કરતા પહેલા સ્ત્રી અને પુરુષે  
દ્યાનમાં રાખવા જેવી બાબતો

ગર્ભ ધારણાની પ્રક્રિયા

ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહીને  
ગર્ભવતીનો આહાર,

વિહાર અને વિચાર શું હોવો જોઈએ ?

ગર્ભવતીના શરીરગત ફેરફાર અને  
તેની કુદરતી સારવાર

# ગર્ભસંસ્કાર

હિંદુ ધર્મમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીનાં પવિત્ર સોળ સંસ્કારોનું વર્ણન જોવા મળે છે. આ સોળ સંસ્કારોમાંથી પ્રથમ સંસ્કાર છે એ ગર્ભધારણા સંસ્કાર.

## ગર્ભસંસ્કાર એટલે શું ???

- ગર્ભસંસ્કાર એટલે ગર્ભશાયમાં રહેલા ગર્ભને સંસ્કાર આપવા. ગર્ભસંસ્કારમાં ૨ શબ્દો ગર્ભ અને સંસ્કાર.
- ગર્ભ - ગર્ભશાયમાં પુરુષના શુકાણું(sperm), સ્ત્રીનું બીજાંડ(ovum) અને જીવ એ ત્રણોનો સંયોગ જયારે થાય ત્યારે ગર્ભ રહ્યો એમ કહેવાય.
- સંસ્કાર - એવી પ્રક્રિયા જેના દ્વારા વ્યક્તિ કે પદાર્થોના ગુણોમાં ફેરફાર કરી શકાય તેનું નામ સંસ્કાર.
- એજ રીતે ગર્ભ પર કરવામાં આવતા સંસ્કારને ગર્ભસંસ્કાર કહેવાય.

## ગર્ભસંસ્કાર શા માટે ???

- ગર્ભસંસ્કાર દ્વારા આવનાર બાળકમાં ઈચ્છિત ગુણોનું આરોપણ અને અનિચ્છિત ગુણોનું પરીવર્જન કરી શકાય છે.
- આ સિવાય ગર્ભધાન થયા બાદ અનેક પ્રકારનાં પ્રાકૃતિક દોષોનું અસંતુલન થાય છે જેનાથી બચવા માટે સંસ્કાર જરૂરી છે.
- ગર્ભસંસ્કાર દ્વારા સુયોગ્ય, નીરોગી અને સ્વસ્થ બાળક મેળવી શકાય છે.
- બાળકમાં માતા પિતા ક્યાં પ્રકારનાં ગુણો લાવવા ઈચ્છે છે તે મુજબનાં પુસ્તકોનું અધ્યયન કરવાથી એવા ગુણોને બાળકમાં પ્રબળતા લાવી શકાય.

## ગર્ભધાન

- ગર્ભધાન એટલે ગર્ભને ધારણા કરવું.
- ગર્ભધારણા ની પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ છે પુરુષબીજ(SPERM) અને સ્ત્રીબીજ(OVUM)નો સંગમ.
- જો સ્ત્રી અને પુરુષનું શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક આરોગ્ય સારું હોય તો સંતતિ પણ એવી જ સ્વસ્થ અને નીરોગી થાય છે.


# ગર્ભસંભવ સામગ્રી (ગર્ભ માટે જરૂરી પરિબળો)

## ગર્ભધાન માટે યોગ્ય અસ્તુ



યોગ્ય પાક મેળવવા માટે યોગ્ય અસ્તુની જરૂર હોય છે... જેમ કે શીયાળા માં દંડઊનું વાવેતર થાય

એમજ અસ્તુની ક્રષ્ણીએ - હેમંત, શિશિર, વસંત શ્રેષ્ઠ અસ્તુ સ્ત્રીનો માસિકધર્મ આવી ગયા બાદનો ૧૨ થી ૧૮ દિવસનો.



## ક્ષેત્ર (ખેતર/ સારી જમીન) / ગર્ભશાય



જેમ પાક માટે ફળક્રૂપ જમીન જોઈએ



એમ જ ગર્ભની સ્થાપના માટે સ્ત્રીનું શરીર નીરોગી અને સ્વસ્થ ગર્ભશાય જોઈએ

## અભુ - પાણી / આહાર-પોષક રસ



જેમ સારા પાક માટે જમીનને પાણી જોઈએ



એમ જ આહાર દ્વારા ગર્ભ-બાળકનું પોષણ થાય છે તેથી જ માતાએ નવ મહિના દરમિયાન પૌષ્ટિક, તાજો, સાત્વિક તથા સમતોલ આહાર લેવો જોઈએ.

## બીજ (સ્ત્રીબીજ, પુરુષબીજ)



સ્ત્રીબીજ - માસિક પણીના ૧૨ થી ૧૮ દિવસોમાં સ્ત્રીબીજ છુટું પડતું હોય છે જેને ovulation કહેવાય છે.

પુરુષબીજ - શુક્ક બીજમાં શુકાણુંની સંખ્યા ૩૦-૩૦૦ મિલિયન, માત્રા ૨ થી ૫ ml, ભોટાલિટી ૫૦% સામાન્ય રીતે હોવી જોઈએ.

માતા અને પિતા બંને શારીરિક તેમજ માનસીક રીતે બાળકને લાવવા માટે તૈયાર છો ? ? ?  
તો જ ગર્ભધારણાનો પ્રયત્ન કરવો જોઈએ.



## ગોકુલ નેચર કથોર સેન્ટરમાં

ગર્ભધારણ કરતા પહેલા સ્ત્રી અને પુરુષ ને શારીરિક તેમજ માનસીક રીતે સંપૂર્ણ તૈયાર કરવામાં આવે છે.

કાઉન્સેલિંગ અને કન્સલટેશન ઢારા દંપતીના શોખ અને ગુણોનું પરિક્ષણ કરવામાં આવે છે.

દંપતી પોતાના બાળકમાં જે ગુણો ઈચ્છતા હોય જેવા કે સુંદર, સુશીલ, વિવેકી, સંસ્કારી, દાનવીર વગેરે નો વિકાસ બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેનું બીજા રોપણ થાય તે હેતુથી અનેક પ્રવૃત્તિઓ જેવી કે યોગ, સંગીત, વાંચન, બ્રેઇન એક્ટિવીટી, માટીકામ વગેરે કરાવવામાં આવે છે.

**તેના માટે ગોકુલ નેચર કથોર સેન્ટરમાં શારીરશુદ્ધિ, મનોશુદ્ધિ તેમજ આહાર આચ્યોજન કરાવવા માં આવે છે. જેમ કે....:**

### શારીરશુદ્ધિ

- આહાર- વિહાર અને વિચાર ઢારા જીવનશૈલીનું પરિવર્તન
- માલીશ, શેક, લેપ જેવી બાધ્ય ચિકિત્સા

- શરીરશુદ્ધિથી સ્ત્રી અને પુરુષનાં વાત, પિત, કફના દોષો દુર થાય છે.
- શરીરશુદ્ધિ - બીજ (sperm, ovum), બીજભાગ (genes), બીજભાગાવયવ (chromosomes) ના લેવલ સુધી કામ કરે છે તેથી બાળકમાં આવતી જન્મજાત ખોડખાપણ અટકાવી શકાય છે તેમજ ડાયાબીટીસ, બીપી, થાયરોઇડ જેવા રોગો જે વારસાગત રીતે બાળકમાં આવવાની શક્યતા હોય તેને પણ અટકાવી શકાય.




આહાર



ઔષધ



યોગ



શીરોધારા



માલીસ



નગોડશોક



વરાળ સ્નાન



માટી લેપ

## મનોશુદ્ધિ

- જેમાં પ્રાણાચામ, ઓમકાર, સાત્વિક આહાર, દ્યાન, શુદ્ધ આચરण તેમજ સજ્જનો સંપર્ક એ મહત્વના છે.
- યોગ - દ્યાન દ્વારા માનસીક ચિકિત્સા

## આહાર માટે દ્યાનમાં રાખવા જેવી બાબત

- શરીરશુદ્ધિની મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા પછી બીજની તાકાત વધારવા માટે શક્તિવર્ધક આહાર લેવો જરૂરી છે.

## સમાગમ પૂર્વે દ્યાનમાં રાખવા જેવી બાબતો

## વિહાર અંગે દ્યાનમાં રાખવા જેવી બાબતઃ

- પહેરવેશ.
- યોગ, પ્રાણાયામ, દ્યાન.
- ઉત્તમ સાહિત્યનું વાંચન, શાસ્ત્રીય સંગીત, આધ્યાત્મિક ભજનોનું શ્રવણ કરવું.
- ઉચ્ચ વિચારોવાળા, આચારવાળા તથા બુદ્ધિશાળી મનુષ્યોનો સંગ.

## ગર્ભ રહ્યા બાદ દ્યાનમાં રાખવા જેવી બાબતઃ

- ગર્ભ રહ્યા બાદ એક થી નવ મહીના દરમિયાન કરવામાં આવતું કાઉન્સેલિંગ અને કન્સલટેશન.
- માસાનુમાસીક પરીચર્યા.
- ગર્ભબાળનો શારિરિક, માનસીક અને બૌધ્ધિક વિકાસ સારો થાય તે માટે પુંસવનન સંસ્કાર કરવામાં આવે છે.
- સીમંતોન્નયન સંસ્કાર.
- બાળકના શારિરિક તથા માનસીક વિકાસ ને અનુલક્ષીને આપવામાં આવતી અન્ય વિવિધ પ્રવૃત્તિઓ.



### કુદરતી ઉપયાર કેન્દ્ર

૯ ગોમટા, તા. ગોંડલ, જી. રાજકોટ - 360 320

ફોન : 02825-285401 / 2 ફોન નંબર : 70961 77767 / 72010 77767  
ઈમેઇલ : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org) ઈમેઇલ ID : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)



## કુદરતી ઉપયાર કેન્દ્ર

ગોમટા, તા. ગોંડલ, જી. રાજકોટ - 360 320

ફોન : 02825-285401 / 2 મો. 70961 77767 / 72010 77767

વૈબરિંગ : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org) ઈમેઇલ : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)



world diabetes day

14 November

# ડાયાબિટીસ

ડાયાબિટીસને સાદી ભાખામાં સમજુયે તો લોહીમાં શર્કરાનું (ગ્લુકોઝ)નું પ્રમાણ જરૂરત કરતા વધે અને વધતું જાય...

- W.H.O. ના ખત મુજબ કોઈ પણ રોગ કરતા ડાયાબિટીસના દર્દીઓ વધારે છે.
- હાલમાં દર આઠમો માણસ ડાયાબિટીસથી પીડાય છે. જે ૨૦૨૫ સુધીમાં વધીને પાંચ થવાની શક્યતા છે.
- ભારતમાં ૧૦ કરોડથી વધારે ડાયાબિટીસના દર્દીઓ છે જે દુનિયાના કુલ ડાયાબિટીસના દર્દીઓના ૨૦ ટકા જેટલા છે.
- ૧૯૮૦ થી ૨૦૧૫ સુધીમાં તેમાં ૪ ગણો વધારો થયો છે. બગડતી જતી જીવનશૈલી આ માટે કારણાભુત છે.

# ચાલો, આપણે ડાયાબિટીસ વિશે સમજુયે!!!



- ડાયાબિટીસના પ્રકારો, લક્ષણો તથા કારણો.
- ડાયાબિટીસમાં આહાર, વિહાર તથા વિચાર.
- ડાયાબિટીસ મેનેજમેન્ટ - કુદરતી ઉપયાર.

## ડાયાબિટીસના પ્રકારો

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) પ્રમાણે મુખ્ય ત્રણ પ્રકારો:

- ટાઇપ - ૧ ડાયાબિટીસ
- ટાઇપ - ૨ ડાયાબિટીસ
- જેસ્ટેશનલ ડાયાબિટીસ

## પ્રિ-ડાયાબિટીસ (જ્લુકોઝનું અપૂર્તું નિયમન)

આ તબક્કામાં દર્દીના લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું વધેલું હોય છે. પરંતુ તે પ્રમાણ એટલું વધારે નથી હોતું કે જેનું ડાયાબિટીસ તરીકે નિદાન થઈ શકે. આવા દર્દીઓને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે.

## ડાયાબિટીસના નિદાન માટે લોહીમાં જ્લુકોઝ નું પ્રમાણ :

લોહીમાં શર્કરાનું પ્રમાણ	સામાન્ય	અપૂર્તું જ્લુકોઝ નિયમન (Prediabetes )	ડાયાબિટીસ
જુખ્યા પેટે ( ખોરાક લીધા પછી ૮ થી ૧૪ કલાકે )	૧૧૦ થી ઓછું	૧૧૦ થી ૧૨૬	૧૨૬ કે તેથી વધુ
જમ્યા પછી બે કલાકે	૧૪૦ થી ઓછું	૧૪૦ થી ૨૦૦	૨૦૦ કે તેથી વધુ

## ડાયાબિટીસ થવાનાં કારણો

આહાર, બેઠાંસું જીવન, મેદસ્વીતા, વચ્ચ, માનસિક તણાવ, વારસાગત, પ્રજાતી, કુટેવો, અનિયમીત જીવનશૈલી, અંતઃસ્ત્રાવોમાં વધઘટ, કેટલીક દવાઓ, (સ્ટીરોઇડ, ગર્ભનીરોધક ગોળીઓ, ડાઇયુરેટિક્સ)



## ડાયાબિટીસના લક્ષણો

- તરસ તેમજ વધારે પડતી ભુખ લાગવી
- વારંવાર પેશાબ થવો
- ઝડપથી વજન ઘટવું
- શરીર સતત થાકેલું અને સુસ્તા રહેવું
- આળસ, ગમગીની વધી જવાં
- કામકાજમાં કંટાળો આવવો
- બેચેની રહેવી અને ઉલ્ટી થવી
- ચામડી, કાન અને યોનીમાર્ગમાં વારંવાર ચેપ લાગવો અને ખંજવાળ આવવી
- અંખમાં અંધાપો આવવો કે ઝાંખપ આવવી
- બેહોશ થઈ જવું

## બેકાબુ ડાયાબિટીસને કારણે ઉદ્ભવતી તકલીફો

- રક્તવાહિનીઓની તકલીફ
- ચેતાતંતુઓની તકલીફ
- ગેંગ્રીન
- મુત્રપિંડની તકલીફ
- આંખની તકલીફ
- છદ્ધયરોગ
- સ્ટ્રોક
- ચામડીની તકલીફ

## ગોકુલ નેચર ક્યોર માં ડાયાબીટીસ માટે કુદરતી ઉપયાર કરાવો...

### આહાર



- સંપૂર્ણ શાકાહારી આહાર.
- ઓછી ચરબીવાળો આહાર.
- કાર્બોહાઇફ્રેટ્સ - સીંપલ, કોમ્પલેક્ષ.
- પ્રોટીન - 1 gm/kg કરતા વધારે નહીં.
- રેસા - ક્રાવ્ય, અક્રાવ્ય, ખુબ જરજરી.
- મીહું - 6 gms/day કરતા વધારે નહીં.
- કુત્રિમ ગળપણ નહીં.

ડાયાબિટીસમાં કોઈપણ આહાર લેતા પહેલા એ જાણવું જરૂરી થઈ જાય કે તેમાંથી કેટલી સુગાર મળશે અને કેટલી જલ્દી સુગાર છુટી પડશે? ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે દુનિયાની સૌથી પ્રસિદ્ધ સંસ્થા અમેરીકન ડાયાબિટીક એસોશિયેશન અને સીડની યુનિવર્સિટીએ સાથે મળીને દુનિયાનાં મોટા ભાગના ખાદ્ય પદાર્થોનાં આ બે આંક કાઢ્યા છે.

ગ્લાયસેમિક ઈન્ડેક્શન - GI	ગ્લાયસેમિક લોડ - GL
કેટલી જલ્દી સુગાર છુટી પડે.	કેટલી સુગાર છુટી પડે.
Speed	Quantity

## વिहार



**કસરત-વ્યાયામ કરવામાં :** નિયમિતતા જાળવવી, મન ને આનંદ આવે તેવી, સહજતાથી, સજગતાથી, ધ્યાનપુર્વક, હાથ પગના અંગળા લાલ થાય ત્યા સુધી, ભુખ્યા પેટે ગમે ત્યારે, જ્યાના રૂપો કલાક પછી કસરત કરવી.

**કસરતના પ્રકારઃ** ચાલવું, દોડવું, જુમ, રમતો રમવી, નાચવું, બાગકામ, ઘરકામ, યોગ, પ્રાણાયામ, અન્ય શારીરીક શ્રમના કામ.

**પ્રાણાયામ અને ધ્યાનઃ** અનુલોભ વિલોભ પ્રાણાયામ, બ્રાભરી પ્રાણાયામ, ઝોડ ધ્યાન, સહજ શ્વાસ ધ્યાન.

## વિચાર - તણાવ

શારિરિક - માનસીક તણાવ અને ડાયાબિટીસ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.



**તણાવ ઉત્પત્તિ થવાના પરિબળો:**

- બાધ્ય - કામનો બોજ, આર્થિક, કૌદુર્યિક, સામાજુક.
- આંતરીક - પોતાનું વ્યક્તિત્વ, પરિસ્થિતિની પ્રતિક્રિયા.

**તણાવમુક્તિ :**

જીવનશૈલી પરિવર્તન, જાગૃતતા, યોગ, પ્રાણાયામ, યોગ નિદ્રા, ધ્યાન, પ્રાર્થના, સ્વાધ્યાય, સેવા, સ્વ-અધ્યનન, સંગીત, કાઉન્સેલીંગ, મનગમતી પ્રવૃત્તિઓ, રમતો, બાળકો સાથે રમત ગમત, આમજનો સાથે આનંદાયક સમય પસાર કરવો.



## કુદરતી ઉપચાર

- વૈજ્ઞાનિક માલીશ
- માટી ચીકિત્સા - માટી પણ્ણી, સર્વાગ માટી લેપ
- જલ ચીકિત્સા - કટી સ્નાન, સ્પાઇનલ સ્પ્રે, વરાળ સ્નાન, ગરમ ઠંડા શેક
- G.H. Pack - ગેસ્ટ્રોહેપેટીક પેક

## ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે મહત્વની તથા સમયાંતરે ધ્યાનમાં રાખવાની બાબતો

- ભુખ્યા પેટે તથા જમ્બ્યા પછી રક્ત શર્કરાનું પ્રમાણ જોતા રહેવું
- રક્ત શર્કરાના પ્રમાણને નિયંત્રણમાં રાખવું
- HbA1C ની તપાસ દર રૂ 3 થી 5 મહિને દર ત્રણ મહિને ડોક્ટર દ્વારા તપાસ
- વજન, બ્લડ-પ્રેશર તથા લોહીમાં ચરબીના પ્રમાણ ને નિયમનમાં રાખવું
- આંખની તપાસ દર વર્ષે એક વખત
- કિડનીની તપાસ દર વર્ષે એક વખત, 40 વર્ષથી ઉપરની વય માટે ECG દર વર્ષે એક વખત
- બીડી, સીગારેટ, તમાકુ બંધ કરવા
- બાળકોમાં ડાયાબિટીસ થયો હોય તો બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ બરાબર થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું

## તરત ડોક્ટરનો સંપર્ક કરો

- પગમાં ઘા પડે, ઘા રૂક્ખાય નહીં, પગની આંગળીઓની વરચ્યે ફૂગનો ચેપ, મોઢા માં છાલા પડે કે લોહી નીકળે, ચામડીમાં ચેપ, જનનાંગોમાં ચેપ, ગુમડા થાય, આંખમાં ઝાંખપ



## કુદરતી ઉપચાર કેન્દ્ર

૭ ગોમટા, તા. ગોંડલ, જી. રાજકોટ - 360 320

ફોન : 02825-285401 / 2 ફોન મો. 70961 77767 / 72010 77767  
વૈબરન : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org) ઈમેલ : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)



NATURE CURE CENTRE

## કુદરતી ઉપયાર કેન્દ્ર

ગોમટા, તા. ગોંડલ, જી. રાજકોટ - 360 320

ફોન : 02825-285401 / 2 ફોન નંબર : 70961 77767 / 72010 77767

વૈશ્વિકારિક : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org) ઈમેઇલ : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)

સાંધા નો દુખાવો  
આર્થરાઇટીસ માં  
નિસર્ગોપયાર



શું તમને આર્થરાઇટીસ છે?

આર્થરાઇટીસ એટલે શું ?

આર્થરાઇટીસ ના પ્રકાર.

આર્થરાઇટીસ થવાના કારણો

આર્થરાઇટીસ ના લક્ષણો.

આર્થરાઇટીસ માં નિસર્ગોપયાર

# આર્થરાઇટિસ એટલે શું ?

## આર્થ સાંધાઓ (Joints) + રાઇટિસ સોજો (Swelling)

સાંધા માં આવતા સોજા ને આર્થરાઇટિસ કહે છે.

### આર્થરાઇટિસના લીધે :


- જે તે ભાગ માં દુખાવો થાય
- લાલાશ આવી જાય
- જે તે ભાગ ગરમ રહે
- જે તે અંગ જકડાઈ જાય

## આર્થરાઇટિસ ના પ્રકાર

સામાન્ય રીતે આપણી આસપાસ જોવા મળતા આર્થરાઇટિસ ના પ્રકાર માં નીચે પ્રમાણે છે.

### ▲ ઓસ્ટીઓઆર્થરાઇટિસ - સાંધા નો ઘસારો

- સાંધાની વર્ચ્યે આવેલું પ્રવાહી ઓષ્ઠ થવાથી, કાર્ટિલેજ (Cartilage) નું સ્તર ઘસાય છે. જેથી બજે હાડકા એકબીજા સાથે ઘસાવાનું શરૂ થાય છે અને હાડકા ની સપાટી ખરબચડી બની જાય છે.



### ▲ રૂમેટોઇડ આર્થરાઇટિસ - ઓટો ઇભ્યુન ડિસીસ

- રોગ પ્રતિકારક તંત્રની ગડબડ ને કારણે રૂમેટોઇડ આર્થરાઇટિસ થાય છે. રોગ પ્રતિકારક તંત્ર શરીર ને રોગના હુમલા સામે રક્ષણ આપે છે, પરંતુ રૂમેટોઇડ આર્થરાઇટિસ માં કોઈ કારણ સર શરીર પોતાના જ ભાગ ને રોગ સમજુ પોતાના ઉપર હુમલો કરે છે, જેને કારણે સાંધા માં સોજા આવે છે અને રૂમેટોઇડ આર્થરાઇટિસ થાય છે.



## ગાઉટ

- જ્યારે ચુરિક એસીડ લોહી માં ક્રાવ્ય થવાની બદલે કણ બની સાંધા માં એક્ફુ થાય છે ત્યારે જેતે ભાગ માં દુખાવો અને સોજા આવે તેને ગાઉટ કહે છે.

## સાંધાના દુખાવાના અન્ય કારણો

- પોષક તત્વો ની ઉણાપ-** ઓસ્ટીઓપોરોસીસ
- ઈજા -** સ્પ્રેઇન અને સ્ટ્રેઇન (Sparin / Strain)
- સોરીચાટીક આર્થરાઇટીસ**
- ચીકન ગુનિયા-** કમર - ગરદન નો દુખાવો
- મણાકા ના સાંધા નો ઘસારો - સ્પોન્ડિલોસીસ -** મણાકા વરચે ગાઢી ખસી / સરકી જવી / પ્રોલેપ્સ ડિસ્ક
- સાચટીકા**
- મણાકા નો વા -** એન્કેલોસીગ સ્પોન્ડિલાઇટીસ
- મણાકા ની ખોડખાપણ -** સ્પોન્ડિલોલીસ્થેસીસ)
- ક્રોડરજુ સાંકડી થવી** (Spinal Canal Stenosis)

## સાંધા નો દુખાવો થવાના સામાન્ય કારણો

- ઉંમર:** ૫૦ પછી હાડકા બરડ થતા હોય છે, જેના લીધે ઘસારો જોવા મળે છે.
- જાતિ:** પુરુષો કરતા શ્રીઓ માં સાંધાનો ઘસારો વધુ જોવા મળે છે કારણ કે રજોનીવૃત્તિ પછી હોર્મોનમાં અસમતુલા થવાથી શરીર માંથી કેલ્સિયમ ઓછુ થાય છે.
- અનુવાંશિક:** વારસાગત સાંધાનો ઘસારો જોવા મળે છે.
- બેઠાળું જીવન:** વ્યાચામ વગરની બેઠાળું જીવનશૈલી હોવાથી સ્નાયુઓ ની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે, જેના લીધે પોષક ક્રાવ્યો નો પુરવઠો હાડકા સુધી પહોંચતો નથી અને ઘસારો થવાની શરૂઆત થાય છે.
- સ્ટ્રેસ:** તણાવને કારણે શરીરમાં જરૂર કરતા વધુ સાયટોકીન્સ પરમાણું છુટા પડે છે, જે શરીરમા સોજા અને સ્નાયુઓ માં તણાવ પેદા કરે છે અને દુખાવો થાય છે.
- વધુ પડતું વજન:** વધુ વજન હોય તો શરીરના વજન ઉચ્કતા સાંધા જેવા કે ધૂંટણા, ધૂંટી, કમર, થાપા ઉપર વજનના દબાણને કારણે ઘસારો થવા લાગે છે.



- **સાંધા નો વધુ ઉપયોગ:** રોજુંદા કામકાજમાં અમુક સાંધાનો વધુ ઉપયોગ થતો હોય જેમકે કોમ્પ્યુટર ઉપર કામ કરવાથી હાથના નાના સાંધામાં, તેમજ દરજુકામ કરતા પગની ઘૂંઠીમાં, વજન ઉપાડતા વ્યક્તિના કમર તેમજ ગરદન ના સાંધાઓ માં ઘસારો જોવા ભળે છે.
- **વધુ પડતો વ્યાચામ:** અસામાન્ય રીતે, શારીરીક ક્ષમતા બહાર, જરૂર કરતા વધુ કરાતો વ્યાચામ સાંધા નો ઘસારો નોતરે છે.
- **આહાર:** આજકાલ મળતા ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા તેમજ તીખા તળેલા, ખાટા પદાર્થો નું સેવન શારીરમાં એસીડ તેમજ ઝેર નું પ્રમાણ વધારે છે. જે સાંધાના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
- **Posture (ફબ):** બેસવાની, ચાલવાની, ઉભા રહેવાની, સુવાની ફબ પણ તમારા સાંધા ના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
- **સાંધા માં ઈજા:** સાંધા માં થયેલી ઈજા પણ લાંબા ગાળે સાંધા માં ઘસારો લાવે છે.

## ઉપાય

### આહાર

#### આલ્કલાઇન આહાર

- આલ્કલાઇન આહાર એટલે એવો આહાર જે શારીર માંથી એસીડ ને ઓછો કરી, ઝેરી ફ્રાન્ટ્યો / વિજાતિય ફ્રાન્ટ્યો ને શારીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે.



## ▲ એન્ટી ઓક્સિડન્ટ તેમજ એન્જાઇમ

- એન્ટી ઓક્સિડન્ટ એટલે એવા તત્વ જે કોશો ને રીપેર (repair) કરવાનું કામ કરે છે. એન્ટી ઓક્સિડન્ટ તાજા શાકભાજુ તેમજ ફળો માં પણ જોવા મળે છે. વનસ્પતિ માંથી પણ મળે છે. જેમકે કુવારપાહું, તુલસી, લીલી ચા, ગળો, આદુ, લીમડો, હળદર, મધ, લસણા, આમળા, વગેરે.
- અનાનસમાંથી બ્રોમોલીન એન્જાઇમ મળે છે, જે સાંધામાં સોજા ઓછા કરે છે.

## ▲ વિટામીન D કેલ્સિયમ ચુક્ત આહાર

- દૂધ તેમજ દૂધ ની બનાવટ (છાસ, દહીં નહિ), સરગવો (સરગવાની સીંગ, પાન, તેમજ ફૂલ), નારીયેલ અથવા કોપરં, બ્રોકલી, કોળાના બીજ, મીઠો લીમડો, તલ તેમજ જીરું, કેળું વગેરે માં વિટામીન D તેમજ કેલ્સિયમ ભરપુર પ્રમાણમાં મળે છે.
- વિટામીન D કેલ્સિયમ હાડકા ને ઘસારા થી રક્ષણ આપી મજબુત બનાવે છે તેમજ પોલા પડી ગયેલા હાડકા માં પુરણા નું કાર્ય કરે છે.

## ઉપયાર :

- અચાનક થયેલા સ્નાયુ ના દુખાવા નું કારણ sprain અથવા strain હોય તો એમાં RICE સારવાર ની રીત કામ માં આવે છે.
- R- Rest (આરામ): શરીર ના તે ભાગ ને આરામ આપવો.
- I- Ice : બરફ નો શેક કરવો - ૧૫ મિનીટ માટે.
- C- Compress : તે ભાગ પછ્ચાથી બાંધી support આપવો .
- E- Elevated above the heart: તે ભાગને છુદયથી ઉચ્ચો રાખવો, જેથી કરી ને સોજો ઓછો થાય.




આહાર



ઔषध



યોગ



શિરોધારા



માલીસ



નગોડશોક



પરાળ સ્નાન



ભાટી લેપ

## વિવિધ થેરેપી :

- વैજ્ઞાનિક માલીસ
- નગોડ નો પોટલી શોક
- કુવારપાંહું હળદર લીમડાનો લેપ
- પરાળ સ્નાન
- લપેટ
- ફૂલ ટબ બાથ
- ઠંડા ગરમ શોક
- સૂર્ય સ્નાન
- રંગ ચિકિત્સા
- કસરત તેમજ ફીજુયોથેરાપી
- એક્ચ્યુપંચર
- સંગીત ચિકિત્સા
- યોગ
- સ્વાસ્થ્યવર્ધક વિચારો
- રોજ નું ર લીટર પાણી પીવું.
- તમાકુ, બીડી, સિગારેટ, દાડુંબંધ
- બહાર નું ફાસ્ટ કૂડ ના ખાવું.
- વાસી ખોરાક નહિ લેવો.
- મન ને પ્રકૃત્લીત રાખવું
- સકારાત્મક અભિગમ રાખવો

## વધુ વિગત માટે સંપર્ક :

**Gokul**  
 NATURE CURE CENTRE  
**કુદરતી ઉપચાર કેન્દ્ર**

- 📍 ગોંઢા, તા. ગોંડલ, જી. રાજકોટ-360 320
- ☎ : 02825-285401 / 2
- 📠 : 70961 77767 / 72010 77767
- 🌐 : [www.gokulnaturecure.org](http://www.gokulnaturecure.org)
- ✉ : [info@gokulnaturecure.org](mailto:info@gokulnaturecure.org)